#029

🎯 Choice is Yours.. 😃

એક મિનિટ માટે રોકાઈને પોતાને પૂછો—
જ્યારે તમે શરૂ કર્યું હતું, ત્યારે તમારો Goal શું હતો?

થાક આવશે, સમય નહીં મળે, લોકો સપોર્ટ નહીં આપે…
આ બધું excuses છે.

Excuses આપણને આરામ આપે છે,
પણ Goal આપણને આગળ લઈ જાય છે.

જે લોકો આગળ વધે છે,
એ લોકો perfect નથી,
એ લોકો excuses છોડે છે.

દરેક દિવસ પોતાને પૂછવું જોઈએ — “આજે મેં Goal માટે શું કર્યું?” જવાબ ખાલી મળે તો,
સમજો કે excuses જીત્યા.

મિત્રો યાદ રાખીએ…
Goal આપણને ઓળખ આપે છે
Excuses આપણને અટકાવે છે

આજે જ નિર્ણય લઈએ —
Goal યાદ રાખીશ, excuses ભૂલી જઈશ.